



## ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર

બ્લોક નં. ૧૬, ભોયતળીયે, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

ફોન નં- ૦૭૯-૨૩૨૫૯૪૮૯/૮૭/૮૮/૮૯ ફેલ્પ લાઈન નં-૮૪૦૧૪૦૨૩૦૩

વેબસાઇટ:- [www.sje.gujarat.gov.in/gtkvn](http://www.sje.gujarat.gov.in/gtkvn) મેઈલ:- [md-gtkvn@gujarat.gov.in](mailto:md-gtkvn@gujarat.gov.in)

### સીધા ઘિરાણ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવા અંગેની જાહેરાત

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગફસ્તકના નિયામકશ્રી, વિ.જા.ક., ગાંધીનગર તથા રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ, નવી દિલ્હીના સહયોગથી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક અને સ્વરોજગારલક્ષી ધંધા / વ્યવસાય માટે ઓછા દરના વ્યાજની લોન યોજનાઓ જેવી કે (૧) મુદ્દતી લોન (ટર્મ લોન), (૨) માઇક્રો ફાયનાન્સ, (૩) મહિલા સમૃદ્ધિ યોજના, (૪) ન્યુ સ્વર્ણિમા યોજના, (૫) સ્વયં સક્ષમ યોજના અમલમાં છે. જેનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીના ઠાકોર અને કોળી જાતિના લોકો પાસેથી ઓનલાઇન અરજીઓ તા.૨૮/૦૮/૨૦૨૫ થી તા.૨૭/૦૯/૨૦૨૫ સુધી મંગાવવા online portal ખોલવામાં આવનાર છે.

આ યોજનાઓમાં લાભ લેવા, નિગમના પોર્ટલ <http://gtkdeonline.gujarat.gov.in> તથા વેબસાઇટ [sje.gujarat.gov.in/gtkvn](http://sje.gujarat.gov.in/gtkvn) પરથી ઓનલાઇન અરજી કરી તેની સાથે જણાવેલ આધાર પુરાવાઓ (pdf format)માં અપલોડ કરવાનાં રહેશે. (ઓનલાઇન અરજી કરવા જરૂર જણાય તો નિગમની વેબસાઇટ પરથી અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.)ની કચેરી /જિલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) કચેરીએથી યોજનાઓની માહિતી મેળવી લેવાની રહેશે.)

#### યોજનાની પાત્રતા:

- (૧) યોજનાની પાત્રતાની વિગતો નિગમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જે ધ્યાનમાં રાખીને અરજી કરવી.
- (૨) સ્વરોજગારની લોન યોજનામાં અરજદારની વય મર્યાદા ૨૧ વર્ષથી ૫૦ વર્ષ રહેશે. (સ્વયં સક્ષમ લોન યોજનામાં અરજદારની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ સુધીની રહેશે.)
- (૩) અરજદારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩,૦૦,૦૦૦/-ની રહેશે.
- (૪) સ્વરોજગારની લોન યોજનાનો લાભ માટે કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે.
- (૫) અરજી કરતી વખતે આધાર નંબર સાથે લીંક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.
- (૬) અરજીમાં અરજદારે પોતાનો જ મોબાઇલ નંબર આપવાનો રહેશે. અતેથી પુર્તતા કે મંજુરી અર્થે આ નંબર પર માહિતી મોકલવામાં આવતી હોઈ મોબાઇલ નંબર ચાલુ સ્થિતીમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલો હોય અથવા એક જ નંબરથી વધુ અરજીઓ કરેલ હોય તો આવી અરજીઓ રદ્પાત્ર ગણવામાં આવશે.
- (૭) અરજીમાં સંપુર્ણ વિગતો ભરેલી નહી હોય અથવા અધુરા દસ્તાવેજો વાળી અરજી હોય તો તે આપોઆપ રદ્પાત્ર (નામંજુર) ગણાશે.
- (૮) નિગમની તમામ યોજનાઓના વ્યાજદર બાબતે સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી થયેલ વ્યાજદર લાગુ પડશે.
- (૯) જુના અધુરા દસ્તાવેજોવાળી અરજીઓ દફ્તરે કરવામાં આવે છે. તે અરજદારો નવેસરથી અરજી કરી શકશે
- (૧૦) લોન મેળવાની અરજી નિગમ દ્વારા સૈધ્યાંતિક રીતે મંજુર થયેથી સ્થાવર મિલકત ધરાવતાં બે જામીનદાર તથા મંજુર કરેલ લોનની રકમની દોઢગણી રકમની પોતાની અથવા જામીનદારની સ્થાવર મિલકતમાં બોજાનોંધ કરાવવાની રહેશે. તેમજ નિયમાનુસાર લોન એગ્રીમેન્ટ, એક વરે રજુ કરવાના રહેશે.
- (૧૧) જે ધંધા/વ્યવસાય હેઠળ અરજી કરેલ હોય તે જ ધંધા માટે લોન મળવાપાત્ર થશે એકવાર અરજી કર્યા બાદ પછીથી કોઈ પણ સંજોગોમાં અન્ય યોજનામાં અરજી તબદીલ કરવામાં આવશે નહિ.

નોંધ:- ન્યુ આકાંક્ષા યોજના અંતર્ગત આપવામાં આવતી શૈક્ષણિક લોન માટે ઉક્ત પોર્ટલ ઉક્ત દિવસ ખુલ્લુ રાખવામાં આવેલ છે.

ઉપરોક્ત આપવામાં આવેલ જાહેરાત સંદર્ભમાં મળેલ લોન અરજીઓ નાણાકીય જોગવાઇને ધ્યાને લઈ મંજુર/નામંજુર કરવાનો આખરી નિર્ણય સરકારશ્રીના નિતિ નિયમોને આધિન ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ, ગાંધીનગરનો રહેશે.

સ્થળ: ગાંધીનગર

તારીખ:- ૨૮/૦૮/૨૦૨૫

મનેજીંગ ડિરેક્ટર

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ

ગાંધીનગર